



**JAB-16070701054600** Seat No. \_\_\_\_\_

**B. R. S. (Sem. V) (CBCS) (W.E.F.-2016) Examination**

**October – 2019**

**Agriculture Chemistry : ELT-15**

**Analysis of Irri. Water**

*(New Course)*

Time : 2 Hours]

[Total Marks : 50

- ૧ પાણીમાં રહેલ કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આયનના પૃથ્વકરણનો પ્રયોગ ૧૦  
વિસ્તારથી સમજાવો.

**અથવા**

- ૧ 10 ml પિયતના પાણીનું 0.1N  $H_2SO_4$ ની મદદથી પૃથ્વકરણ કરતાં,  
ફિનોલ્ફથેલીન અને મિથાઈલ ઓરેંજ સૂચક દરમ્યાન રીડિંગ અનુકૂળ  
3.2 ml અને 5.8 ml આવે છે, તો તે પાણીમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ  
આયનના m.e./l, ppm અને % શોધો. ૧૦

- ૨ વિગતે ઉત્તર આપો : (કોઈપણ એક) ૧૦

- (૧) પાણીનો અભલતા આંક માપવાનો પ્રયોગ વર્ણવો.  
(૨) પિયતના પાણીમાંથી કલોરાઇડ આયનના પૃથ્વકરણનો પ્રયોગ  
વિગતે સમજાવો.

- ૩ ટૂંકનોંધ લખો : (કોઈપણ ગ્રાણ) ૧૫

- (૧) પિયતના પાણીના પૃથ્વકરણનું મહત્વ  
(૨) EC આધારીત પાણીનું વર્ગીકરણ  
(૩) SAR આધારીત પાણીનું વર્ગીકરણ  
(૪) કેલિયમ અને મેનેશિયમ આયનનાં પૃથ્વકરણનો સિદ્ધાંત  
(૫) વાહકતા કોષ

- (૧)  $\text{Ca}^{++}$  અને  $\text{Mg}^{++}$ ના પૃથ્વીકરણમાં વપરાતા પદાર્થોના નામ લખો.
  - (૨) RSCનું સૂત્ર જણાવો.
  - (૩) કાર્બોનેટની ગણતરી દરમ્યાન રીડિંગ શા માટે ડબલ લેવામાં આવે છે ?
  - (૪) વિદ્યુતવાહકતાના એકમો જણાવો.
  - (૫) ESP આધારીત પાણીનું વર્ગીકરણ કરો.
  - (૬) પાણીનો નમૂનો પૃથ્વીકરણ માટે તૈયાર કરવાની રીત જણાવો.
  - (૭) કદમાપક પૃથ્વીકરણમાં વપરાતા સાધનોના નામ જણાવો.
-